

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટનને ફોર્સ દ્વારા 2022 માં કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સ પૈકી એક તરીકે ઓળખ મળી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 27, 2022) – સીટી ઓફ બ્રેમ્પટનને ફોર્સ દ્વારા [2022 માટે કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સ](#) પૈકી એક તરીકે ઓળખ મળી.

આ વર્ષે, સીટીને 300 માંથી 98મું ક્રમાંકન મળ્યું, અને આ સતત ચોથું વર્ષ છે કે જ્યારે સીટીને યાદી પર ક્રમાંકન મળ્યું હોય.

ફોર્સ વાર્ષિક યાદી તૈયાર કરવા માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટા (Statista) સાથે ભાગીદારી કરી, 500 થી વધારે કર્મચારીવાળી કંપનીઓ માટે કાર્યરત 10,000 થી વધારે કેનેડિયન નાગરિકોનો સર્વે કર્યો. સહભાગીઓએ તેઓની ભલામણ મિત્રો અને કુટુંબીજનોને કરવાની તૈયારી બતાવી તેના આધારે તેઓની સંસ્થાનું ક્રમાંકન કર્યું. તેઓને તેઓની પોતાની સિવાયની બીજી સંસ્થાઓને નામાંકિત કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.

સીટી ઓફ બ્રેમ્પટન ઝાંખીઓ

- જાન્યુઆરી 2022 માં, સીટી ઓફ બ્રેમ્પટને દૂરસ્થ રહીને કામ કરવું (રિમોટ વર્ક), લચીલો સમય, કામ વહેંચણી અને કામના સંકુચિત અઠવાડિયાઓ માટેના વિકલ્પો સહિત; કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં અને ત્યારે લચીલાપણુંને સહાયરૂપ થતો ફ્લેક્સિબલ વર્ક પ્રોગ્રામ શરૂ કર્યો. આ પ્રોગ્રામ કાર્યસ્થળે આધુનિકીકરણ પહેલનો ભાગ છે, જેમાં લચીલા કાર્ય વિકલ્પોને સમાવવાનો અને સહયોગને સહાયરૂપ થવાનો સમાવેશ પણ થાય છે.
- વર્ષ 2020 માં, સીટીએ સમુદાયમાં અશ્વેત-વિરોધી જાતિવાદ સામે અર્થપૂર્ણ કાર્યવાહી કરવા ઇકોનોમિક એમ્પાવરમેન્ટ એન્ડ એન્ટી-બ્લેક યુનિટ સ્થાપ્યું. વર્ષ 2021 માં, આ યુનિટ ગલન સામુદાયિક સલાહ-મસલતો, કોન્ફરન્સીસ અને કાર્યક્રમોનું આયોજન કરીને પંચવર્ષીય કાર્યવાહી યોજનાના વિકાસને ટેકો આપ્યો હતો. સીટીએ આંતરિક બ્લેક એમ્પ્લોયી એન્ગેજમેન્ટ નેટવર્ક પણ વિકસાવ્યું, અને પરફોર્મિંગ આર્ટ્સમાં બ્લેક એન્ડ ઇન્ડિજનસ યુથ ઇન્ટર્નશિપ એન્ડ કો-ઓપ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જે કેનેડામાં તે પ્રકારનો પહેલો કાર્યક્રમ હતો.
- ડિસેમ્બર 2020 માં, સીટીએ [પોતાના કર્મચારીઓ અને નાગરિકોને સેવા આપવા નવી ઇકિવટી ઓફિસ](#)ની ઘોષણા કરી હતી. ઇકિવટી ઓફિસ કાર્યસ્થળે અને સમુદાયમાં અવરોધકો ઓળખવા અને હટાવવા પર ધ્યાન આપે છે, જેમાં સમુદાયનો વંશ, કૂળ, મૂળ દેશનું સ્થળ, રંગ, વંશીય મૂળ, અશક્તતા, નાગરિકત્વ, જાતિ, લિંગ, જાતીય અભિગમ, લિંગ ઓળખ, સરખા લિંગની ભાગીદારી, ઉંમર, વૈવાહિક સ્થિતિ, કૌટુંબિક મોબો, ઇમિગ્રાન્ટ સ્ટેટસ, જાહેર સહાયતા મેળવવાની, રાજકીય જોડાણ, ધાર્મિક જોડાણ, સાક્ષરતાનું સ્તર, ભાષા અને/અથવા સામાજિક-આર્થિક સ્થિતિ ભલે ગમે તે હોય.

ક્વોટ્સ (અવતરણો)

“અમે ફોર્સ દ્વારા સતત ચોથા વર્ષ માટે કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સ પૈકી એક તરીકે ઓળખ મળવા બદલ અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. બ્રેમ્પટન એક સુસંચાલિત શહેર છે, અને અમારા કર્મચારીઓ આપણાં રહેવાસીઓ માટે એવા સમુદાયનું નિર્માણ કરવા સમર્પિત છે જે સુરક્ષિત, કાયમી અને સફળ હોય. આ અમારા કર્મચારીઓ માટે પસંદગીના એમ્પ્લોયર બનવાની ઓળખ આપણાં સમુદાય માટે તેઓનો જુસ્સો બતાવે છે, અને આપણાં રહેવાસીઓ માટે પરિણામો મેળવવાની વાત છે.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“બ્રેમ્પટન એક મોજેઈક (રચના) છે, અને શહેરમાં અમે સર્વગ્રાહી કાર્યબળ (વર્કફોર્સ) વિકસાવવાનું ચાલુ રાખી રહ્યાં છીએ જે આપણાં વૈવિધ્યસભર સમુદાયને પ્રતિબિંબિત કરે છે. આપણી ઇકિવટી ઓફિસ તરીકે આવી પહેલો મારફતે, અમે સીટીના કર્મચારીઓ માટે સુમેળભર્યા

વાતાવરણની અને બધાં લોકો સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણની ખાતરી કરાવવા કાર્યરત છીએ જેથી કરીને આપણે અવરોધો વિના, બહુ શ્રેષ્ઠ ઉમેદવારોને આકર્ષી શકીએ છીએ. આપણે કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સ પૈકી એક તરીકે ફોર્સ તરફથી ઓળખ મળવા બદલ ઉજવાણી કરીએ છીએ.”

- હરકિરત સિંહ (Harkirat Singh), અધ્યક્ષ, કોર્પોરેટ સેવાઓ; સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10, સીટી ઓફ બ્રમ્પટન

“સીટી ઓફ બ્રમ્પટન કાર્યસ્થળે અવરોધો હટાવવાના અને આપણાં કાર્યસ્થળનું આધુનિકીકરણ કરવાના પગલાઓ લેવાનું ચાલુ રાખે છે જેથી કરીને તે સૌ માટે નિષ્પક્ષ અને યોગ્ય હોય. અમારા કર્મચારીઓ આપણાં વૈવિધ્યસભર સમુદાયને સેવા આપવાનો જુસ્સો ધરાવે છે, અને સર્વગ્રાહી અને પ્રવૃત્તમય કાર્યસ્થળ સંસ્કૃતિ બનાવતી વખતે, અમે તેઓ માટે તકો રચવા સમર્પિત છીએ. અમને ફોર્સ દ્વારા સતત ચોથા વર્ષ માટે કેનેડાના ટોચના એમ્પ્લોયર્સ પૈકી એક તરીકે મળેલી ઓળખ માટે ગૌરવ છે!”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; ઉપપ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રમ્પટન

“સીટી ઓફ બ્રમ્પટનમાં, અમે અમારી કાઉન્સિલની અગ્રતાની પરિભાષા પૂરી પાડવાની સહાયારી કટિબદ્ધતા આધારિત, આપણાં લોકોને પ્રવૃત્તમય બનાવતી, વિકસાવતી અને ઉજવતી સર્વગ્રાહી સંસ્કૃતિને પોષવા કટિબદ્ધ છીએ. એ અમારી 6,000 થી વધારે કર્મચારીઓની ટીમ છે જે સીટીને કામ કરવાનું ચડિયાતું સ્થળ બનાવે છે. ફોર્સ અને આપણાં કર્મચારીઓ – ભૂતકાળમાં અને હાલમાં – કેનેડાના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સ પૈકી એક તરીકે સતત ચોથા વર્ષ માટે દ્વારા ઓળખ મેળવવી એ ચડિયાતી ઉપલબ્ધિ છે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મીડિયા સંપર્ક:

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

multiculturalmedia@brampton.ca